

પ્રકરણ - ૧૦

સહકાર શાખા હસ્તકની કામગીરી

ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ - ૧૯૬૧ અન્વયે ગ્રામ્ય ક્ષાત્રની સહકારી મંડળીઓની નોંધણી, તેના પેટા કાયદાઓમાં સુધારા વધારા કે આ કાયદા ની જોગવાઈ હેઠળ ફરિયામાં ગયેલ હોય તેવી સહકારી મંડળીઓને પુનઃજીવિત કરવાની તેમજ કમીશનરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ ખાતા હસ્તક ની ગ્રાન્ટ મળ્યેથી હાલમાં કર્ષ તાલુકાના માધાપર તથા કુકમા ગામમાં હાથશાળ તાલીમ કેન્દ્ર દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવે છે.

સહકારી મંડળીઓની નોંધણી કામે જિલ્લા પંચાયત ની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ માં ઠરાવથી નિર્ણય કરી નોંધણી ની કામગીરી હાથ ધરવામાં આવે છે. સેવા સહકારી મંડળીઓની નોંધણી માટે આ સુપરવિઝન સમિતિમાં આ મંડળી અર્થક્ષમ હોવાના નિર્ણય અર્થે મુકી આ સમિતિ ને માન્ય રહેતી તેની નોંધણી અંગેની અંતિમ કાર્યવાહી કરવામાં આવે છે. તે સિવાય બાકીની મંડળીઓની નોંધણી અંગે તથા તેની અન્ય વહીવટી કામગીરી માટેના અધિકારો જિલ્લા પંચાયત ની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિને આપવામાં આવેલ છે.

આ શાખા ધ્વારા નીચે પ્રમાણેના પ્રકારવાળી મંડળીઓની નોંધણી/વહીવટી કામગીરી કરવામાં આવે છે.

- ગ્રામ વિકાસ સહકારી શ્રમયોગી સહકારી મંડળી
- સેવા સહકારી મંડળી
- પિયત (ખેતી) સહકારી મંડળી
- ગ્રાહક સહકારી મંડળી
- હાઉસીંગ (ગૃહ) સહકારી મંડળી
- ઔદ્યોગિક સહકારી મંડળી
- કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળી
- અન્ય મંડળી

રાજ્ય કુટીર ઉદ્યોગો અને ગ્રામ્ય ઉદ્યોગો વિભાગ હેઠળના ચાર તાલીમ કેન્દ્રોનું સંચાલન કરવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રોમાં એક વર્ષ સુધી વ્યવસાયલક્ષી સઘન તાલીમ આપવામાં આવે છે. તાલીમ પુર્ણ થયા બાદ કુટીરઉદ્યોગો દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને પ્રમાણપત્રો આપવામાં આવે છે. આ તાલીમાર્થીઓ તાલીમ નો ઉપયોગ કરી શકે તે માટે તાલીમ બાદ ફોલોઅપ ની કામગીરી હાથ ધરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે લોન સહાય મળી રહે.

શાખાના સ્ટાફની વિગત વર્ષ

ક્રમ	સંવર્ગ	મંજૂર જગ્યા	ભરાયેલ જગ્યા	ખાલી જગ્યા
૧	મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર	૧	૧	૦
૨	સી.ક્લાર્ક (વહીવટ)	૧	૧	૦
૩	જુ.ક્લાર્ક	૧	૦	૧
૪	સીનીયર એકાઉન્ટ ક્લાર્ક(હિસાબી)	૧	૦	૧
૫	પટ્ટાવાળા	૧	૧	૦
કુલ		૫	૩	૨

માહિતી મેળવવાનો અધિકાર

અરજદાર તરફથી માંગવામાં આવતી માહિતી માટેની અરજી સ્વીકારવાનું કામ આ શાખા હસ્તે કરવામાં આવે છે અને તેનું સંકલન કરવામાં આવે છે.

નાગરીક અધિકારપત્ર

નાગરીક અધિકારપત્રની માહિતી જિલ્લા પંચાયતની તમામ શાખાઓ દ્વારા અત્રે આપવામાં આવે છે. યોજનાની વિગત : અત્રેની શાખા હસ્તક કોઈ યોજના નથી.